

## Annexure C

### PROFORMA FOR SAFE DRINKING WATER AND SANITARY CONDITION CERTIFICATE

No. 1605/24

Dated: 07/07/24

It is certified that an inspection team headed by Rakesh T. Verma (Quality Manager)

(Name of Officers with designation) from GNSSB Dahod PHED

inspected the EMR School Lukhadiga (Taluka: Dhampur)

(Name & Address of the school) on 15/7/2024 (date of inspection) and on the basis of

Water Test Report (Attached) bearing no. 146/2024-25 dated 15/07/2024

of GNSSB Dahod (PHED Lab) certified that the


EMR School Lukhadiga (Name of school) has safe drinking water

facilities for the students and members of staff of the institution. School is also maintains the

hygienic sanitation condition in the school building & the campus as per norms prescribed by the

Central/ State/ U.T. Govt.

This certificate is valid till Six Months from Report

Signature with Seal: 

Name : Kalpana B. Rane

Designation : Executive Engineer

Name & Address of the Office / Department : P. H. Works Division

DHOD

To EMR School Lukhadiga  
At: Lukhadiga, Post: Nalu, Dhampur  
(Name & Address of the Institution)

Note: The certificate is to be issued by authorized officer / PHED Lab / local bodies





IS-10500:2012 (2<sup>nd</sup> Revision)

Sr. No.	Parameter	Unit	Requirement (Acceptable Limit)	Permissible Limit in the Absence of Alternate Source
			Max.	Max.
1	Colour	Hazen	5	15
2	Odour	Qualitative	Agreeable	Agreeable
3	Taste	Qualitative	Agreeable	Agreeable
4	Turbidity	NTU	1	5
5	pH at 25°C	-	6.5 to 8.5	No relaxation
6	Conductivity at 25°C	µS/cm	-	-
7	Total Dissolved Solids	Mg/L	500	2000
8	Total Hardness (as	Mg/L	200	600
9	Calcium (as Ca)	Mg/L	75	200
10	Magnesium (as Mg)	Mg/L	30	100
11	Chloride (as Cl)	Mg/L	250	1000
12	Sulphate (as SO <sub>4</sub> )	Mg/L	200	400
13	Nitrate (as NO <sub>3</sub> )	Mg/L	45	No relaxation
14	Fluoride (as F)	Mg/L	1	1.5
15	Total Alkalinity (as CaCO <sub>3</sub> )	Mg/L	200	600